

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ-ગાંધીનગર
અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેની અગત્યની જાહેરાત

મંડળની જા.ક. ૧૮૨/૨૦૧૯૨૦ - ચીફ ઓફીસર, વર્ગ-૩ સંવર્ગની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અને બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ એમ બંને પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ સંયુક્ત ગુણના મેરીટ્સ તેમજ કેટેગરીવાઈઝ ભરવાની થતી જગ્યાના આધારે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ કરી, યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી તા. ૩૦/૧૨/૨૦૨૦ ના રોજ કરવામાં આવેલ હતી.

ઉક્ત ચકાસણીનાં અંતે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં કેટેગરીવાઈઝ સમાવવાપાત્ર ઉમેદવારો ઉપલબ્ધ ન થતાં કેટલાક વધુ સંભવિત ઉમેદવારોની અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવી જરૂરી બનતાં ઉક્ત જાહેરાત/સંવર્ગની યાદીમાં નીચે દર્શાવ્યા મુજબના ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી મંડળની કચેરી ખાતે **તા.**

૧૦/૦૩/૨૦૨૧ના રોજ સવારના ૧૨-૦૦ કલાકે રાખેલ છે. જે અંગે ઉમેદવારોને એપ્લીકેશનમાં રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર સંપર્ક કરવામાં આવી રહેલ છે. તેમ છતાં કોઈ ઉમેદવારનો સંપર્ક પ્રમાણપત્રોની ચકાસણીની તારીખ પહેલાં થયેલ ન હોય તો પણ તેવા ઉમેદવારે ઉક્ત ચકાસણીની તારીખે અચૂક ઉપસ્થિત રહેવાનું રહેશે. પ્રમાણપત્રોની ચકાસણી સમયે ઉમેદવારોએ સાથે પોતાની જાતિ, વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, વગેરેને લગતા અસલ પ્રમાણપત્રો તેમજ તેની એક ઝેરોક્ષ નકલ (પ્રમાણિત/સ્વપ્રમાણિત) અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો લાવવાનો રહેશે.

જે ઉમેદવાર ઉપર વર્ણવેલ નિયત તારીખે અને સમયે પ્રમાણપત્રોની ચકાસણી માટે ઉપસ્થિત નહીં રહે તો તેવા ઉમેદવારને નોકરીની જરૂરિયાત નથી તેમ માનીને મંડળ દ્વારા તેઓને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર આગળની ભરતી પ્રક્રિયામાંથી પડતા મુકવામાં આવશે. તેમજ તેવા ઉમેદવાર ઉક્ત બંને કસોટી - સ્પર્ધાત્મક લેખિત કસોટી અને કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી કસોટીમાં મેળવેલ ગુણના મેરીટ્સ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન મેળવવાપાત્ર હશે તો પણ તેઓનો હક્ક આપોઆપ રદ થયેલ ગણવામાં આવશે અને તે સામેની તેઓની કોઈ રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. જેની નોંધ લેવા પણ જણાવવામાં આવે છે.

પ્રમાણપત્રોની ચકાસણી માટેનું સ્થળ:-


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, બ્લોક નં. ૨, પહેલો માળ, કર્મચોગી ભવન, નિર્માણ ભવનની પાછળ, સેક્ટર-૧૦ એ, ગાંધીનગર

જા.ક. ૧૮૨/૨૦૧૯૨૦ – ચીફ ઓફીસર, વર્ગ –૩ માં પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થતા વધારે ઉમેદવારોની યાદી

LIST OF CANDIDATES CALLED FOR DOCUMENT VERIFICATION (Additional List)				
FOR THE POST OF CHIEF OFFICER CLASS - 3 (ADVT. NO. 182/201920)				
VERIFICATION of AGE, QUALIFICATION, CASTE AND ALL OTHER ELIGIBILITY CRITERIA				
Sr. No.	Roll No. Written Exam	Roll No. Comp. Profi. Exam	Name	Gender
1	182008534	182000038	Mr. NITIN RAVJIBHAI KORAT	M
2	182002406	182000008	Ms. MEGHANA JANAKBHAI DHARAIYA	F

નોંધ:- પ્રથમ તબક્કાની ચકાસણીમાં પસંદગી/પ્રતિક્ષા યાદીમાં કેટેગરીવાઈઝ સમાવવાપાત્ર ઉમેદવારો ઉપલબ્ધ ન થતાં કેટલાક વધુ સંભવિત ઉમેદવારોને બીજા તબક્કામાં અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે જરૂરિયાત કરતાં કેટલાક વધારે ઉમેદવારોને બોલાવવામાં આવેલ છે. તેથી પ્રમાણપત્રોની ચકાસણીને અંતે લાયક ઠરેલ તમામ ઉમેદવારોનો સમાવેશ પસંદગી/પ્રતિક્ષા યાદીમાં થઈ જ જશે તેવું માની લેવાનું રહેશે નહીં. અને તેથી ઉપર દર્શાવેલ યાદીમાં પોતાના નામના સમાવેશ માત્રથી કોઈ ઉમેદવાર તેઓનો પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવેશ માટેનો કોઈ હક્ક દાવો કરી શકશે નહીં.

સ્થળ: ગાંધીનગર
તા. ૦૫/૦૩/૨૦૨૧


સચિવ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
ગાંધીનગર